



DR-19080001060603

Seat No. _____

Third Year B. Com. (Sem. VI) (CBCS)

(W.E.F. 2019) Examination

April - 2022

GST-2

(DSE-3) (New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : દરેક પ્રશ્નના ગુણ જમણી બાજુએ દર્શાવેલાં છે.

- ૧ GST અને ઇનપૂટ ટેક્સ ક્રેડિટનો ખ્યાલ સમજાવો અને પાત્ર-અપાત્ર ઇનપૂટ ટેક્સ ક્રેડિટ વિશે સ્પષ્ટતા આપો. ૨૦

અથવા

- ૧ CGST, SGST અને IGST સંદર્ભ ઇનપૂટ ટેક્સ ક્રેડિટ સેટ ઓફ નિયમો સમજાવો અને GSTR-2 ફાઈલિંગ માટેની શરતો ચર્ચો. ૨૦

- ૨ સમજાવો : ૨૦
 (૧) GST ક્રેડિટ ફાળવણી અને સ્થગિત ક્રેડિટ્સ
 (૨) ખાસ સંજોગોમાં ટેક્સ ક્રેડિટની પ્રાપ્યતા.

અથવા

- ૨ નોંધ લખો : ૨૦
 (૧) કેપિટલ ગુડ્સના વેચાણ અને ખરીદી પર GST ક્રેડિટ નિયમો.
 (૨) ઇનપૂટ ક્રેડિટની ફેરબદલી.

- ૩ GST ફાઈલિંગ અંગે “ટેક્સ ઇનવોઈસ” “ક્રેડિટ નોટ” તેમજ “ડેબિટ નોટ” સમજાવો. ૧૫

અથવા

- ૩ GST ફાઈલિંગ માટેના રિટર્નર્સના પ્રકારો જણાવી, GST ઓડિટ આકારણી વિધી ચર્ચો. ૧૫

- ૪ GST હેઠળ કરપાત્ર મૂલ્ય એટલે શું ? GST ચુકવણી માટે ચલાન તૈયાર કરવાની પ્રક્રિયા સમજાવો. ૧૫

અથવા

- ૪ GST સંદર્ભે, CPIN, TDS અને TCS વિશે વિગતવાર સમજૂતી આપો. ૧૫

ENGLISH VERSION

Instruction : Marks of each question are shown on the right side.

- 1 Explain the concept of GST and Input Tax Credit and give clarification in regards to eligible and ineligible input tax credit. **20**

OR

- 1 Explain the set off rules for input tax credit with reference to CGST, SGST and IGST and discuss the prerequisites for filling GSTR-2. **20**

- 2 Explain : **20**
(1) GST credit appointment and blocked credit
(2) Availability of tax credit in special circumstance.

OR

- 2 Write notes : **20**
(1) GST credit rules on sales and purchases of capital goods.
(2) Transfer of input credit.

- 3 Explain “Tax Invoice”, “Credit notes”, and “Debit notes” for GST filling. **15**

OR

- 3 State the types of Returns for GST-filling and discuss the procedure of GST-Audit assessment. **15**

- 4 What is taxable value under GST ? Explain the process of prepare (generate) the challan for the payment of GST. **15**

OR

- 4 Give detailed explanation about CPIN, TDS and TCS with reference to GST. **15**
